

SEAT No. _____

No. of Printed Pages : 3

[20]

SARDAR PATEL UNIVERSITY, V.V.NAGAR

B.A. (MASS COMMUNICATION AND JOURNALISM)

SEMESTER - 2

Time: 10:00 to 01:00 PM

Date: 28.03.2018, Wednesday

UA02FCOF01: કમ્પ્યુટરફન્ડામેન્ટલ

Marks:

70

પ્રશ્ન 1 (અ) કોઈ પણ સાત પદ્ધના જવાબ લખો.

14

1. MS WORDમાં ફ્રોપ કેપ એટલે શું?
2. MS WORD કેટલા મેનુ છે?
3. MS WORDમાં ચાર્ટ કેવી રીતે મૂકી શકાય છે?
4. MS WORDમાં પેજ બોર્ડ અને પેજ કલર કેવી રીતે આપી શકાય?
5. MS WORDમાં ફાઈન્ડ અને રિપોર્ટ સમજાવો.
6. MS WORDમાં સુપર સ્ક્રીપ્ટ અને સબ સ્ક્રીપ્ટ સમજાવો.
7. બુકમાર્ક સમજાવો.
8. MS WORDમાં ફેદર અને ફુટર સમજાવો.
9. MS WORDમાં ડેટ અને રાઇમ કેવી રીતે મૂકી શકાય?

(બ) કોઈ પણ બે પદ્ધના જવાબ લખો.

1. MS WORDમાં ઓટો ટેક્સ્ટ સમજાવો.
2. MS WORDમાં વોટરમાર્ક સમજાવો.
3. MS WORDમાં ટેબલ કેવી રીતે મૂકી શકાય? ટેબલમાં મર્જ અને સ્થિસ્ટ સેલ સમજાવો.

06

પ્રશ્ન 2 (અ) કોઈ પણ બે પ્રક્રિયા જવાબ લખો.

10

1. MS WORDમાં કેટલા પ્રકારના વ્યૂ છે? સવિસ્તાર સમજાવો.
2. MS WORDમાં ફૂટનોટ અને એન્ડનોટ સમજાવો.
3. આપેલા વિકલ્પ માટે શૉર્ટકટ કી લખો.
 1. સેન્ટર એલાઈનમેન્ટ
 2. રાઈટ એલાઈનમેન્ટ
 3. લેફ્ટ એલાઈનમેન્ટ
 4. હાયપર લિંક
5. ફોન્ટની સાઈઝ વધારવા
6. અન્ડ અને રીડ કરવા માટે
7. બોલ્ડ, ઇટાલિક કરવા

(બ) કોઈ પણ બે પ્રક્રિયા જવાબ લખો.

1. ઇન્સ્ટર મેનુ સમજાવો.
2. પ્રિન્ટ ડાયલોગ બોક્સ સમજાવો.
3. પેજસેટઅપ સમજાવો.

10

પ્રશ્ન 3 કોઈ પણ એક પ્રક્રિયા જવાબ લખો

10

1. MS WORDની લાક્ષણિકતાઓ જણાવો.
2. Mail merge સમજાવો.

(1)

C.P.T.O.C

પ્રશ્ન 4 વૈકલ્પિક પ્રશ્નોના જવાબ લખો.

20

1. ક્યા વ્યૂમાં હેડર અને ફુટર જોવા મળે?
 - a. નોર્મલ વ્યૂ
 - b. પેજ લેઆઉટવ્યૂ
 - c. પ્રિન્ટ લેઆઉટવ્યૂ
 - d. ફ્રાફ્ટ વ્યૂ
2. ઇમેજમાંથી ના જોઈતો ભાગ કાઢી નાખવાની પ્રક્રિયાને શું કહેવાય?
 - a. હાઇડિંગ
 - b. બોર્ડરિંગ
 - c. કોપીંગ
 - d. કટિંગ
3. આંકડા કે અક્ષર સામાન્ય લખાણ થી સહેજ નીચે દેખાય તેને શું કહેવાય?
 - a. સુપર સ્ક્રિપ્ટ
 - b. સબ સ્ક્રિપ્ટ
 - c. સુપર ટેક્સ્ટ
 - d. ટ્રોપ ટેક્સ્ટ
4. પેજ નંબર કઈ જગ્યાએ મૂકી શકાય?
 - a. હેડર
 - b. ફુટર
 - c. A અને B
 - d. એક પણ નહિ
5. મુખ્ય બોડી ટેક્સ્ટમાં કઈ વસ્તુ આંખી દેખાય છે?
 - a. વોટર કલર
 - b. બેકગ્રાઉન્ડ
 - c. વોટરમાર્ક
 - d. બેકકલર
6. આકારની બોર્ડ ને ફુર ફરવા શું, પસંદ કરવું પડે
 - a. નો લાઈન
 - b. નો આઉટલાઈન
 - c. વ્હાઇટ લાઈન
 - d. નો બોર્ડ
7. શબ્દ કે વાક્ય જગ્યારે તેની બોર્ડ પર પહોંચે પછી નવી લાઈન શરૂ કરવાની લાક્ષ્ણિકતા ને શું કહેવાય?
 - a. ટેક્સ્ટ લાઈન
 - b. ન્યુ લાઈન
 - c. ટેક્સ્ટ રેપિંગ
 - d. ટેક્સ્ટ એલાઈન
8. ક્યા વ્યૂમાં ડોક્યુમેન્ટમાં બેક કલર દેખાતો નથી.
 - a. પ્રિન્ટ પ્રિવ્યૂ
 - b. વેબ લે આઉટ વ્યૂ
 - c. પ્રિન્ટ લે આઉટ વ્યૂ
 - d. રીડિંગ વ્યૂ
9. ટ્રોપ કેપ કેટલી જુદી જુદી જગ્યાઓ એ ગોઠવી શકાય?
 - a. ૧
 - b. ૨
 - c. ૪
 - d. ૬
10. નીચે પેકી ક્યા બટનની મદદથી ડેટા સોર્સમાં ડેટા એડ, ડિલીટ અને બદલી શકાય છે?
 - a. ડેટા સોર્સ બટન
 - b. એડિટ બટન
 - c. એડિટ ડેટા સોર્સ બટન
 - d. ડેટા એડિટિંગ બટન
11. વર્ડમાં એક સાથે કેટલા ડોક્યુમેન્ટ ઓપન કરી શકાય?
 - a. ત્રણથી વધારે નહિ
 - b. ફિક્ટ એક જ
 - c. કોમ્પ્યુટરની મેમરી હોય તેટલા
 - d. ટાસ્કબારમાં દેખાય તેટલા
12. MS WORDમાં પહેલેથી જ ટાઈપ કરેલ, સ્પેલિંગ, કેપિટલાઈઝેશન અને ગ્રામરની ભૂત શોધવા અને સુધારવાની યાદી હોય છે તેને _____ કહેવાય.
 - a. ઓટોએન્ડ્રી
 - b. ઓટોકરેટ
 - c. ઓટોએડ
 - d. ઓટોસ્પેલ
13. સૌથી વધારે વપરાતા કમાન્ડ અને ફુલને કઈ જગ્યાએ મુકવામાં આવે છે.
 - a. સ્ટેટ્સ બાર
 - b. ફુલ બાર
 - c. મેન્યુ બાર
 - d. ટાઈટલ બાર

(2)

14. ઓટોક્રેટનો ઉપયોગ _____ શબ્દોને બદલવા થાય છે.

- a. ટ્રેકા અને વારેવારે વપરાતા
- b. ગ્રામર ખોટ હોથ તેવા
- c. સ્પેલિંગ ખોટ હોથ તેવા
- d. એક પણ નહિ

15. એન્ડ ક્રી નો ઉપયોગ

- a. કર્સરને લાઈનના અંતમાં લઈ જાય છે.
- b. કર્સરને ડોક્યુમેન્ટના અંતમાં લઈ જાય છે.
- c. કર્સરને ફકરાના અંતમાં લઈ જાય છે.
- d. કર્સરને સ્કીનના અંતમાં લઈ જાય છે.

16. પેજ અપ કી નો ઉપયોગ

- a. કર્સરને એક લાઈન ઉપર જશે.
- b. કર્સરને એક સ્કીન ઉપર લઈ જશે.
- c. કર્સરને એક પેજ ઉપર લઈ જશે.
- d. કર્સરને એક ફકરો ઉપર લઈ જશે.

17. MS OFFICEનું વેલીડ વર્જન કયું છે?

- a. OFFICE XP
- b. OFFICE 2007
- c. OFFICE VISTA
- d. એક પણ નહિ

18. પેજ ઓરીએટેસન વિષે શું સાચું છે?

- a. પેજ ઓરીએટેસન ગમે તે સમયે બદલી શકાય છે.
- b. પેજ ઓરીએટેસન પ્રિન્ટર દ્વારા નક્કી થાય છે.
- c. પેજ ઓરીએટેસન ટાઇપિંગ ચાલુ કરતા પહેલા નક્કી કરવામાં આવે છે.
- d. પેજ ઓરીએટેસન બદલી શકાય નહિ.

19. MS WORDમાં ડિઝેલ્ટ ફોન્ટ ક્યાં છે?

- a. કેલીબરી
- b. વીંદા
- c. ટાઈમ્સ ન્યુ રોમન
- d. કેમ્બ્રિયા

20. MS WORDમાં રૂલર નો શો ઉપયોગ છે?

- a. ટેબ સેટ કરવા માટે
- b. ઈન્ડેન્ટ સેટ કરવા માટે
- c. પેજ માઝિન સેટ કરવા માટે
- d. ઉપરના બધા

—X—

(3)

